

વિષય:એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજનામાં આપે કરેલ અરજીના ફસ્ટ-રેન્યુલના દસ્ટાવેજો મોકલવા બાબત

પ્રિય વિઢાર્થી,

ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮થી શરૂ થયેલ એજ્યુકેશન લોન પર વ્યાજ સબસીડી યોજનાનો લાભ મેળવવા આપના દ્વારા અરજી કરવામાં આવેલ હતી. જે અંતર્ગત આપશ્રીને ૨૦૧૭-૧૮માં વ્યાજ સબસીડી યોજનાનો લાભ મળેલ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં પણ વ્યાજ સબસીડી યોજનાનો લાભ મેળવવા માટે આપશ્રીને નીચે મુજબના દસ્ટાવેજો જમા કરાવવા જણાવવામાં આવે છે.

૧.એક્નોલેજમેન્ટ રિસિપ્ટ(ફોર્મ ભરતી વખતે જનરેટ થયેલ હોય તે).

૨.વિઢાથીના આઢારકાર્ડની સ્વપ્રમાણિત નકલ.

૩.વર્ષ ૨૦૧૮-૨૦૧૯ની ઈન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન શીટ(અસલ કોપી બેંક મેનેજરના સહી અને બેંક સીલ સાથે).

૪.વર્ષ ૨૦૧૮-૧૯નું આઈ.ટી.આર ફોર્મ/જો આઈ.ટી.આરના ભરતા હોય તો કરપાત્ર આવક ન હોવાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ.

૫.વર્ષ ૨૦૧૮-૧૯નો આવકનો દાખલો.

૬.લોન એકાઉન્ટની પાસબુકના પ્રથમ પેજની નકલ.

૭.લોન એકાઉન્ટનું બેંક સ્ટેટમેન્ટ.(લોન લીધી ત્યારથી)

૮.વિઢાથીના પ્રથમ/ બીજા વર્ષની માર્કશીટની નકલ (સેમેસ્ટર સીસ્ટમ હોય તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ).

૯.કોલેજમાં ફી ભર્યાની તમામ રસીદની નકલ (બીજા સેમેસ્ટર કે વર્ષની).

ખાસ નોઢ:

૧.બેંક સિવાયના બધાં દસ્ટાવેજો સેલ્ફ અટેસ્ટેડ હોવા જોઈએ તેમજ અધૂરા દસ્ટાવેજો સ્વીકારવામાં આવશે નહીં.

૨.ડોક્યુમેન્ટ અંગે કોઈ પ્રશ્ન હોય તો હેલ્પલાઈન નંબર ૯૯૦૯૦૩૯૩૮૦ અને Email ID:-isel.kcg@gmail.com પર સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી સંપર્ક કરવાનો રહેશે. પબ્લિક હોલીડેમાં અને બપોરે ૧:૦૦ થી ૨:૦૦ લંચ બ્રેક હોવાથી હેલ્પલાઈન નંબર બંધ રહેશે.

૩.ઉપર માંગેલા ડોક્યુમેન્ટ એપ્લીકેશન સાથે જમા કરાવેલ હશે તો પણ ઉક્ત ડોક્યુમેન્ટ ફરી જમા કરાવવાના રહેશે.

૪.ઉપરોક્ત જણાવેલ દસ્ટાવેજો તા.૦૧/૦૪/૨૦૧૯ થી તા.૧૦/૦૪/૨૦૧૯ સુધીમાં કે.સી.જી કચેરી, અમદાવાદ ખાતે રૂબરૂ અથવા કુરિયર મારફતે મોકલાવાના રહેશે.

પ.ઈન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન શીટ ભરવામાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આપને વર્ષ ૨૦૧૭-૧૮ માટે વ્યાજ સહાયનો લાભ મળી ગયેલ છે હવે, આપે માત્ર ૨૦૧૮-૧૯ના વર્ષ માટે વ્યાજ માફી મેળવવાની છે એટલે કે આપે આપેલ સીટમાં માત્ર તા:-૦૧/૦૪/૨૦૧૮ થી તા:૩૧/૦૩/૨૦૧૯ સુધીનું જ વ્યાજ ગણવાનું રહેશે. વધુ સ્પષ્ટતા માટે એક દાખલો સમજીએ.

દા:ખ:

આપે અનુક્રમે નીચે મુજબની તારીખ સામે આપેલ રકમની લોનનો ઉપાડ કરેલ છે.

1	5/8/2017	500000
2	8/2/2018	200000
3	15/05/2018	400000
4	20/09/2018	200000
5	18/02/2019	400000

હાઇલાઇટ કરેલ રકમ આપે વર્ષ ૨૦૧૭-૧૮માં ઉપાડ કરેલ છે એટલે તા:૩૧/૦૩/૨૦૧૮ સુધીનું રૂ.૫,૦૦,૦૦૦ અને રૂ.૨,૦૦,૦૦૦ એમ કુલ રૂ.૭,૦૦,૦૦૦ પરનું વ્યાજ આપને વર્ષ ૨૦૧૭-૧૮માં મળી ગયેલ છે. પણ તા:૦૧/૦૪/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૧૯ સુધી રૂ.૭,૦૦,૦૦૦ પર જે વ્યાજ લાગેલ છે તે આપને મળવાપાત્ર છે. માટે આપે ગણતરી નીચે દર્શાવ્યા મુજબ કરવાની રહેશે.

Name of Student:-													
Registration number:-													
Name of Bank:-													
Interest Calculating Sheet													
Sr. No	Date of Disbursement	Period (01st April or from disbursement date to 31st march)	Period in days	Disbursement Amount	total Disbursement Amount	Amount on which interest to be calculated (Maximum 10,00,000)	Rate of simple Interest	Amount of Simple Interest	Other Charges				Total amount of interest (as per passbook)
									Tax	Processing charge	Penalty	Any other	
1	1/4/2018	14/05/2018	43	700000	700000	700000	8.5	7010					
2	15/05/2018	19/09/2018	127	400000	1100000	1000000	8.5	29575					
3	20/09/2018	17/02/2019	150	200000	1300000	1000000	8.5	34932					
4	18/02/2019	31/03/2019	41	400000	1700000	1000000	8.5	9548					

આપે તા:-૦૧/૦૪/૨૦૧૮ સુધી જેટલી રકમનો ઉપાડ કરેલ હોય તે કુલ રકમ અહી ક્રમ નંબર ૧માં લખાવવાની રહેશે. ત્યારબાદ તા:-૦૧/૦૪/૨૦૧૮ પછી જે તારીખે લોનનો ઉપાડ કરેલ હોય તેનું અમુકમે વ્યાજ ગણવાનું રહેશે. રૂ.૧૦,૦૦,૦૦૦ ઉપરની લોન પર વ્યાજ સરકાર આપતી નથી માટે જો આપની કુલ રકમ રૂ.૧૦,૦૦,૦૦૦ કરતા વધી જાય તો માત્ર રૂ.૧૦,૦૦,૦૦૦ પર જ વ્યાજ ગણવાનું રહેશે. આપે આપના બેંક દ્વારા ચાર્જ કરેલ વ્યાજ ગણતરીમાં લેવાનું રહેશે.અમે અહી સમજાવવા માટે ૮.૫% લીધેલ છે.